



SAURASHTRA UNIVERSITY

Exam Section - 02

University Campus, University Road,
Rajkot – 360005

Phone No.: (0281) 2576511 Ext. No. 734

FAX No.: (0281)2586411 E-mail Id: exam02@sauuni.ac.in



નં/પરીક્ષા/૦૨/ ૧૨૨૨/૨૦૨૨

તા. ૩૦/૦૮/૨૦૨૨

પરિપત્ર :

વિષય : સ્નાતક કોર્સની ઈન્ટરમીડીયેટ સેમેસ્ટર-૩ ની પ્રાયોગિક/ પ્રોજેક્ટ વાઈવા પરીક્ષાઓ બાબતે..

આથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન મેડિકલ / પેરા મેડિકલની સિવાયની લાગુ પડતી તમામ વિદ્યાશાખાના આચાર્યશ્રીઓને જણાવવાનું કે, સને ૨૦૨૨-૨૩ ના પ્રથમ સત્રની પરીક્ષાઓમાં જે વિષયમાં પ્રાયોગિક / પ્રોજેક્ટ વાઈવા પરીક્ષાઓ લેવાની થાય છે ત્યાં જુન-૨૦૧૦થી અમલમાં આવેલ સી.બી.સી.એસ. અંતર્ગત સેમેસ્ટર ૦૩ ના પરીક્ષા ફોર્મ ભરેલ રેગ્યુલર તેમજ રીપીટર પરીક્ષાર્થીઓની પ્રાયોગિક / પ્રોજેક્ટ વાઈવા પરીક્ષા કોલેજ કક્ષાએ (સ્થાનિક ધોરણે) નીચે દર્શાવેલ દિવસો દરમિયાન તમામ કોલેજના આચાર્યશ્રીઓ દ્વારા ગોઠવવાની રહેશે. અને તેની જાણ કોલેજના પરીક્ષાર્થીઓને કરવાની રહેશે.

આચાર્યશ્રી દ્વારા ગોઠવાયેલ ઉપયુક્ત પરીક્ષાઓના કાર્યક્રમની બે નકલ તેમજ આચાર્યશ્રી દ્વારા પ્રાયોગિક પરીક્ષામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક માન્યતા પ્રાપ્ત પરીક્ષકોને અપાયેલ નિમણુંકના ઓર્ડરની એક નકલ પ્રાયોગિક પરીક્ષા શરુ થયાના ૦૩ દિવસ પહેલાં પરીક્ષા નિયામકશ્રી, પરીક્ષા વિભાગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટને મોકલી આપવાની રહેશે.

આ પરિપત્રની તારીખ થી શરુ કરીને ઈન્ટરમીડીયેટ સેમેસ્ટર - ૦૩ (સી.બી.સી.એસ.) ની તા. ૧૯/૧૦/૨૦૨૨ સુધીના સમયગાળામાં ઈન્ટરમીડીયેટ સેમેસ્ટર-૩ના પ્રાયોગિક / પ્રોજેક્ટ વાઈવા પરીક્ષા પૂર્ણ કરવાની રહેશે. અને તેમના ગુણની ઓનલાઈન એન્ટ્રી તા. ૧૯/૧૦/૨૦૨૨ સુધી કરી શકાશે.

વિદ્યાર્થીઓના પ્રાયોગિક પરીક્ષાઓના માર્ક્સની ઓનલાઈન એન્ટ્રી થયા બાદ SAVE કરીને તેની પ્રિન્ટ કાઢીને તેની ખરાઈ કરી તેમાં જે તે વિષયના અધ્યાપકશ્રી તથા આચાર્યશ્રીએ સહી સિક્કા કરી કોલેજના રેકોર્ડ પર રાખવાની રહેશે. યુનિવર્સિટીને જરુર પડે ને મંગાવે ત્યારે નકલ આપવાની રહેશે.

સુચના :-

(૧) સી.બી.સી.એસ. હેઠળના સેમેસ્ટર ૦૩ ની તમામ વિદ્યાશાખાઓના રેગ્યુલર તથા રીપીટર વિદ્યાર્થીઓની પ્રાયોગિક ગુણની એન્ટ્રી G.I.P.L.ના સોફ્ટવેરમાં કરવાની રહેશે.

(૨) વિદ્યાર્થીઓનાં સીટ નંબરની યાદી જે કોલેજને મળેલ ન હોય તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓના નામ અને એનરોલમેન્ટ નંબર ઉપર પ્રાયોગિક પરીક્ષા લેવાની રહેશે. (પ્રાયોગિક પરીક્ષાની ઉત્તરવહીઓ સંસ્થાએ નિર્ધારિત સમય સુધી સાચવવાની રહેશે.)

P.T.O.

...૨...

(૩) આચાર્યશ્રીઓએ પ્રાયોગિક પરીક્ષામાં પોતાની કોલેજનાં સીનીયર શૈક્ષણિક માન્યતા પ્રાપ્ત અધ્યાપકોને પરીક્ષક તરીકે નિમણુંક આપી પ્રાયોગિક પરીક્ષાઓ લેવાની રહેશે, અને જો કોલેજમાં માન્ય અધ્યાપક ન હોય તો, ત્યાંથી નજીકની કોલેજમાંથી માન્ય અધ્યાપકનો સંપર્ક કરીને પરીક્ષા પૂર્ણ કરવાની રહેશે.

(૪) પ્રાયોગિક પરીક્ષાના સંચાલન પેટે જે તે કોલેજનાં આચાર્યશ્રીને કો-ઓર્ડિનેટર તરીકે નિમણુંક કરવા અથવા આચાર્યશ્રી જે અધ્યાપકને નિયુક્ત કરે તેમને રૂ.૧૨૫/- (રૂપિયા એકસો પચ્ચીસ)નું મહેનતાણું પ્રતિ દિન ચુકવવું. આ ફક્ત ગ્રાન્ટેડ/સરકારી કોલેજોને જ લાગુ પડશે.

(૫) આ કાર્યાલયનાં તા.૧૭.૦૮.૨૦૦૯ નાં પરિપત્ર ક્રમાંક પરીક્ષા/૦૨/૧૫૫૧/૨૦૦૯ અનુસાર સેલ્ફ ફાઈનાન્સ કોલેજ તથા ગ્રાન્ટેડ કોલેજોમાં સેલ્ફ ફાઈનાન્સ કોર્ષ ચલાવતી કોલેજોએ પ્રાયોગિક પરીક્ષા સંચાલનનો તમામ ખર્ચ ભોગવવાનો રહેશે, ખર્ચનાં હિસાબોની ફાઈલ યુનિવર્સિટીમાં જમા કરાવવાની રહેશે નહીં, પરંતુ પ્રાયોગિક પરીક્ષા સંચાલન ખર્ચનાં તમામ હિસાબો તૈયાર કરી કોલેજ પોતાના રેકોર્ડ ઉપર રાખવાના રહેશે. જે યુનિવર્સિટીની જરૂરીયાત ઉભી થયે માંગવાથી રજૂ કરવાનાં રહેશે

(૬) ઉપર મુજબની જાણ કોલેજનાં શૈક્ષણિક/બિનશૈક્ષણિક કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓના ધ્યાન પર મૂકવા અને જરૂરી વ્યવસ્થા ગોઠવવા યોગ્ય કરશોજી.

Wings
પરીક્ષા નિયામક

પ્રતિ,

૦૧. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સંબંધિત કોલેજોના આચાર્યશ્રીઓ તરફ

નકલ રવાના:

૧. માન. કુલપતિશ્રી / માન. કુલસચીવશ્રીના અંગત સચિવશ્રી , સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.

૨. હિસાબ વિભાગ , સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.

૩. ઓડીટ વિભાગ , સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.

૪. પરીક્ષા કોમ્પ્યુટર વિભાગ

૫. પરીક્ષા વિભાગ - ૧ , સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ. (પ્રાયોગિક પરીક્ષાઓ માટેની ઉત્તરવહીઓ તથા ગ્રાફ પેપર્સ જે તે કોલેજને સમયસર પહોંચતા કરવા અર્થે.)